

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી રજુ થનાર કેન્દ્રીય બજેટ અંગે સુચનો રજુ કરવામાં આવ્યા...

સમગ્ર દેશ તથા વિશ્વમાં કોરોના મહામારીની સાથે સાથે ઓમિક્રોનનું સંકટ પણ ટોળાઈ રહ્યું છે. જેને કાબુમાં લાવવા અને દેશના લોકો સુરક્ષીત અને સલામત રહે તે ભારત સરકાર દ્વારા અવિરત પ્રયાસો ચાલુ છે. અગાઉની વૈશ્વિક મહામારીમાં વેપાર-ઉદ્યોગ ઉપર ખુબ જ માઠી અસર પડી છે અને આર્થિક મંદીનો પણ સામનો કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૧લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ થનાર છે. ત્યારે વેપાર-ધંધાનો વધુ વિકાસ થાય અને દેશના અર્થતંત્રને આગળ ધપાવવા માટે અમુક રાહતો અને પેકેજો અમલમાં મુકવા ખુબ જ જરૂરી છે. જે અંતર્ગત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રનું આગામી રજુ થનાર બજેટ માટે જરૂરી સુચનો કેન્દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિતારામન સમક્ષ રજુ કરવામાં આવેલ છે.

- (૧) સેક્શન ૮૦ સી અંતર્ગત મળવાપાત્ર તમામ રાહતોની પ્રવર્તમાન મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/- થી વધારી રૂ. ૩,૦૦,૦૦૦/- કરવી.
- (૨) સ્ટીલ તથા મેટલ ઈન્ડસ્ટ્રીઝના કાચામાલ પર બેઝિક કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવો.
- (૩) બિન નિવાસી ભારતીયોએ આવકવેરા ધારા હેઠળ થતી પ્રક્રિયા સરળ અને છુટછાટ વચ્ચે વિથહોલ્ડીંગ ટેક્સ રેટમાં ઘટાડો કરવો.
- (૪) તબીબી સહાય તરીકે મળતા કરલાભની મર્યાદા વધારવી.
- (૫) મિલ્કત વેચાણ થકી મળવાપાત્ર આવકની મર્યાદા વધારવી.
- (૬) સેક્શન ૪૦ એ (૩) અંતર્ગત મળતી રૂ. ૧૦,૦૦૦/- સુધીની કર રાહત વધારીને રૂ. ૨૦,૦૦૦/- કરવી.
- (૭) નાણાંકીય ભરણા તથા લોનની ચુકવણી અર્થે રોકડ રકમ મહત્તમ રૂ. ૨૦,૦૦૦/- ની જોગવાઈ વર્ષ ૧૯૮૪ થી લાગુ કરવામાં આવેલ છે. આ જોગવાઈની મર્યાદા રૂ. ૫૦,૦૦૦/- કરવી.
- (૮) વ્યક્તિગત આવક વેરાના દર ઘટાડવા. કોર્પોરેટ ટેક્સના પ્રવર્તમાન ૨૨% તથા તેના ઉપર લાગુ સેસ તથા સરચાર્જ ઉમેરવાથી થતા ૨૫.૧૭% કરતા વાર્ષિક ૧૦ થી ૧૫ લાખ આવકના કિસ્સામાં વ્યક્તિગત આવકવેરાનો ૩૦% થાય છે. તેમજ ૫૦ લાખથી વધારે આવકના કિસ્સામાં વિવિધ ટેક્સ તથા સરચાર્જને ધ્યાને લેતા ૪૨.૭૫% સુધી ટેક્સ થાય છે.
- (૯) ભાગીદારી પેઢી તથા એલએલપીને લાગુ પડતાં ૩૦% તથા ૧ કરોડથી ઉપરનાં કિસ્સામાં ૧૨% સરચાર્જ તથા ૪% સેસ વસુલવામાં આવે છે. જે વધારે જણાય છે. તથા ભેદભાવ દર્શાવે છે. તેથી આવા એકમોને રાહત આપવી ખાસ જરૂરી છે.
- (૧૦) લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ઉપર વસુલવામાં આવતા સુપર રીચ ટેક્સ વસુલાત અર્થે કરાયેલ જોગવાઈ પાછી ખેંચવી.
- (૧૧) કરદાતાઓને "સામાજિક સુરક્ષા" પુરી પાડવી તથા સિનીયર સીટીઝન માટે "હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ" અમલીકૃત કરવી.
- (૧૨) પ્રધાનમંત્રી આવાસ યોજના CLSS યોજનાનો લાભ લેવા માટે આવાસ ખરીદીની સમય મર્યાદા આગામી તા. ૩૧-૩-૨૦૨૩ સુધી વધારવી.
- (૧૩) રિયલ એસ્ટેટ સેક્ટરને Rationalisation of Taxes નો લાભ આપવો.
- (૧૪) આવાસ ધિરાણ અર્થે લેવાયેલ લોનના કર લાભની પ્રવર્તમાન રૂ. ૨ લાખની મર્યાદા વધારી રૂ. ૫ લાખ કરવી. તેમ જ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જાણવેલ છે.